પ્રચાર પ્રસાર
|| સનાતન પરમો ધર્મ ||
# સનાતન ધર્મ પત્રિકા
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું મુખપત્ર
This edition is for internal circulation of members of ABKKP Social Association
SOCIAL MEDIA USE ONLY
જાગૃત ઉજાગર
સં -૨૦૮૦ | શ્રાવણ વદ - ૦૫ / ૦૬ | તા. ૨૪-૦૮-૨૦૨૪ | શનિવાર | SDP No.:1580 MOB.:+91 7801877774, +91 7718977774 | ankasantandharmpatrika@gmail.com

## શ્રી ભડલી સમાજની ત્રિ-વાર્ષિક સામાન્ય સભામાં નૂતન કારોબારી રચના

શ્રી ભડલી પાટીદાર સ્થાનિક સમાજની ત્રિ-વાર્ષિક સામાન્ય સભા ગત તા.23/08/2024નાં રોજ ભડલી પાટીદાર ભવન મુકામે સવારના 8-30 કલાકે સમાજના પ્રમુખશ્રી બેચરભાઈ ઠાકરાણીના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.

સૌ પ્રથમ મંત્રી રમેશભાઈ ગોરાણી દ્વારા સૌ હોદ્દેદારોને સ્થાન ગ્રહણ કરાવેલ. મંચસ્થ મહાનુભાવોના હસ્તે મા ઉમિયા અને ઇષ્ટદેવના દિપ પ્રાગટ્ય બાદ મિટિંગની શુભ શરૂઆત કરવામાં આવેલ. પ્રમુખશ્રી બેચરભાઈ દ્વારા આજની મિટિંગમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત સાથે આજની મિટિંગની પ્રસ્તાવના કરેલ હતી. મંત્રી રમેશભાઈ દ્વારા ગત સમાન્ય સભાની મિટિંગની મિનિટ્સનું વાંચન કરવામાં આવેલ અને તેની બહાલી મેળવેલ અને ખજાનચી વસંતભાઈ દ્વારા ગત સમયમાં થયેલ જમા ખર્ચની રજુઆત કરીને બહાલી મેળવેલ હતી

છેલ્લે આજની સામાન્ય સભાના એજેન્ડા મુજબની ગતિવિધિઓ અને સમાજ વિકાસના ખુલ્લા ચર્ચા સત્રની કાર્યવાહી પૂર્ણ થતાં પ્રમુખશ્રી બેચરભાઈ ઉદ્બોદન આપ્યા બાદ ચાલુ કારોબારીનો કાર્યકાળ પૂર્ણ થતાં પ્રમુખશ્રી બેચરભાઈ દ્વારા તેને પૂર્ણ થયેલ જાહેરાત કરવામાં આવેલ અને આગામી વર્ષ 2024-27માટેની નવી કારોબારીની નીચે મુજબની જાહેરાત કરવામાં આવેલ છે.

ભડલી પાટીદાર સનાતન સ્થાનિક સમાજની સભામાં શુભ શરૂઆત ઉપસ્થિત હોદ્દેદારો હસ્તે દીપ પ્રાગટ્ય

શ્રી ભડલી પાટીદાર સમાજની સામાન્ય સભા માં ઉપસ્થિત સૌ માન્યવર

છેલ્લે નવનિયુક્ત હોદેદારોને સ્થાન ગ્રહણ કરાવેલ અને નવનિયુક્ત પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈએ સૌના આભાર સાથે જણાવેલ કે આપ સૌ ગામજનોએ અમોને જવાબદારી આપેલ છે તેને પુરી કરવા માટે અમો પુરા પ્રયાસ કરીશું.

સાથે ....સાથે ભડલી પાટીદાર ગૌ સેવા સમિતિ ની પણ મુદત પૂર્ણ થતાં આગામી વર્ષ 2024-27 માટે નીચે મુજબની નવી સમિતિની રચના કરવામાં આવેલ હતી

સંયોજક-રમણીકલાલ ઠાકરાણી,મહારાષ્ટ્ર

નવ નિર્વાચિત પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈ કાલરિયા　મહામંત્રી રમેશભાઈ ગોરાણી

**શ્રી ભડલી પાટીદાર સ્થાનિક સમાજની આગામી વર્ષે 2024-27 માટેની નવી કારોબારી**
પ્રમુખશ્રી:- વિઠ્ઠલભાઈ કરમસી કાલરીયા-ભડલી
ઉપપ્રમુખ:-સામજીભાઈ કરસન ઠાકરાણી- ભડલી
ઉપપ્રમુખ:-ધીરજભાઈ દેવજીભાઈ છાભૈયા-ભડલી
મહામંત્રીશ્રી:-રમેશભાઈ રતનશીભાઈ ગોરાણી-ભડલી
મંત્રી:-મોહનભાઈ ગોવિંદભાઈ ઠાકરાણી-ભડલી
મંત્રી:- વીપીનભાઈ બેચરભાઈ ઠાકરાણી-દેસલપર
ખજાનચી:-વસંતભાઈ સિવગણભાઈ ઠાકરાણી- ભડલી
સહખજાનચી:-રમેશભાઈ દેવજીભાઈ છાભૈયા-ભડલી
ઓડિટર:-વસંત રવજીભાઈ છાભૈયા-બેંગ્લોર

**ગૌ સેવા સમિતિ સભ્યો**
પ્રમુખશ્રી:- જેન્તીભાઈ દેવજીભાઈ છાભૈયા-ભડલી
ઉપપ્રમુખ:-કાંતિભાઈ ડાયાભાઈ ઠાકરાણી- ભુજ
ઉપપ્રમુખ:-દેવરામભાઈ લધા ગોરાણી-ભડલી
મહામંત્રીશ્રી:- રતનશીભાઈ ભીમજીભાઈ ગોરાણી-ભડલી
મંત્રી:-નારણભાઈ લધાભાઈ ઠાકરાણી-ભડલી
ખજાનચી:-પ્રવીણભાઈ કાનજીભાઈ ઠાકરાણી- ભડલી
સહખજાનચી:-કરમસીભાઈ માવજીભાઈ ઠાકરાણી-ભડલી
ઓડિટર :-વસંત રવજીભાઈ છાભૈયા-બેંગ્લોર
અને વિશાલ રણછોડભાઈ ઠાકરાણી

## જાગૃત અને ઉજાગર સમાચાર અને માહિતી રોજ રોજ

હમણાં ઉત્સાહ અને સનાતની સંગઠન નાં મહાપર્વ સાતમ આઠમ એટલે પરંપરાગત થી વિશેષ જન્માષ્ઠમી નિમિત્તે આપણા દેશ વિદેશ અને કચ્છમાં પણ વસતા ભાઈઓ માદરે વતન મેળાવડા અને પ્રસંગો માં ઘણા આવ્યા અને આવવાના પણ હતા.

જેમાં નખત્રાણા, નવાવાસ ના ભાઈશ્રી ગત રોજ સાંજે કઠલાલથી નખત્રાણા સાતમ આઠમ નિમિત્તે આવવાના હતા અને હાર્ટ એટેક આવવાથી દિવંગત થયેલ

એવી જ એક બીજી ઘટનાની પણ. માહિતી આપણને મળી છે

આપણા જ વિગોડી ગામના ભાઈશ્રી સાતમ આઠમ કરવા પંદરેક દિવસ થી બેંગ્લોર થી વિગોડી આવેલ એમનું પણ ગઈકાલે અચાનક અવસાન થયું છે.

તે સિવાય કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી અને લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનના ઉપપ્રમુખ તેમજ જેઓ સનાતન સંગઠન નાં ઊર્જાવાન વડીલ છે તેઓ કેન્દ્રીય સમાજની જનરલ સભાઓ સાથે ઉમિયા સંસ્થાની અનેક બેઠક અને વધુ માં લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્થાન માં પણ સક્રિય ભૂમિકા માં વિવાદ ને સંવાદ માં બદલવા સતત પ્રયાસ કરી રહ્યા છે તેઓ નખત્રાણા થી મદનપુરા જતા જાતે ડ્રાઇવ કરતા નાદુરસ્ત તબિયતના કારણે કાર નો અકસ્માત થયેલ અને તેઓ ને માત્ર થોડી ખરોચ આવી છે તત્કાલીન ભુજ હોસ્પિટલ લઈ જવામાં આવેલ અને ગામ મદનપુરા તંદુરસ્ત અવસ્થામાં આરામ કરી રહ્યા છે . પ્રભુની અકળ કૃપા છે અને પ્રાર્થના છે તેમને ઝડપથી તંદુરસ્તી અર્પે અને પુનઃ સમાજની સંગઠન ની પ્રવૃતિઓ માં ચૈતન્ય સ્ફૂર્તિ અને ઉત્સાહ પૂર્વક જોડાઈ જાય ..

આફત તો તેને જ આવે છે જ્યાં સહન કરવાની શક્તિ વિશેષ હોય છે ..

આપણી સમાજમાં આવી અનેક નાની મોટી ઘટનાઓ નો અહેવાલ આપતા રહેજો આપના અહેવાલની નોધ દેશ દેશાવર માં સનાતન ધર્મ પત્રિકા રોજ રોજ પ્રચાર અને પ્રસાર થકી જાગૃત અને ઉજાગર પૂર્વક માહિતી નો સમાવેશ કરી આપણું પોતીકું જે કેન્દ્રીય સમાજ દ્વારા સંચાલન થઈ રહેલ છે તેવી પત્રિકા નાં માધ્યમ દ્વારા સમગ્ર પરિવાર સુધી પહોંચે છે.

જાગૃત અને ઉજાગર- સનાતન ધર્મ પત્રિકા

## નાગવીરી ગામે ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉત્સવોનો ઉત્સાહ...

નાગવીરી ગામે ભગવાન લક્ષ્મીનારાયણ નૂતન મંદિરના ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જલયાત્રા યોજાઈ.

નાગવીરી ગામે ચાલી રહેલા ચાર દિવસીય ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, ઉમિયા માતાજી, તેમજ અન્ય દેવ દેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે સ્થાપિત દેવો ની પ્રાતઃ પૂજા બાદ ભવ્ય જલયાત્રા નિમિતે મોટી સંખ્યામાં તે ગ્રામજનો જોડાયા હતા. નગર યાત્રા દરમ્યાન ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને તેમજ રામ, સીતા, લક્ષ્મણ તેમજ અન્ય દેવી દેવતાઓ વેશભૂષા એ આર્કષણ જમાવ્યું હતું. બપોર બાદ સંતોના સામૈયા કરવામાં આવ્યા હતા .

*સંત વલ્લભકૃષ્ણ દાસજી (સંસ્કાર ધામ)*
*સદગુરુ શાસ્ત્રી પુરુષોત્તમપ્રકાશ સ્વામી (પી. પી. સ્વામી) સ્વામી નારાયણ મંદિર-અમદાવાદ*

શાસ્ત્રી સ્વામી કૃષ્ણપ્રકાશ જી ,એ આર્શીવચન નો આપ્યા હતા. બંને સંતશ્રી એ નાગવીરી નો સંપ ,એકતા અને અખંડતા થી પ્રશંસા પ્રશંસા કરી અને એજ ભાવના ભવિષ્યમાં ટકાવી રાખવા માટે આહવાન કરેલ. સંતશ્રી એ સભા જનોને વેદ પુરાણ નો મહત્વ સમજાયો અને વડીલોને અનુરોધ કરેલ કે

દાતાશ્રી પરિવારજનો હસ્તે નૂતન મંદિર મૂર્તિ સ્થાપના જલયાત્રા નગરયાત્રા

આપની સનાતન સંસ્કૃતિ ભાવી પેઢી ને વારસામાં આપતા રહેજો.

સંતશ્રી વલ્લભ કૃષ્ણદાસજી એ ગામના સર્વે ભાઈઓ ને નિયાણી ઓને અને વડીલો ના સન્માન માટે ખૂબ આશિષ આપેલ.

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી ગોપાલ બાપા

નાગવીરી ગામે આધ્યાત્મિક જ્ઞાનનો અમૃત પીરસતા શ્રી વલ્લભકૃષ્ણજી

તેમજ સમાજના મહાનુભાવો, અરૂણભાઇ ચૌધરી, જેન્તીભાઈ રામાણી, અને ભાવ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ ને માન આપી પધારેલ 24 ગામના અગ્રણીઓ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ જેમાં મથલ પાટીદાર ગૌ સેવા કેન્દ્ર અને પાટીદાર સેવા સંઘ હિંમતનગર એ હાજરી આપેલ .

સર્વે નું સન્માન આયોજન સમિતિ પ્રમુખશ્રી દેવશીભાઈ લીંબાણી , ગોવિંદભાઈ લીંબાણી , શિવજીભાઈ પોકાર, રતનસિંહ ભાઈ પોકાર હીરાલાલ ભાઈ પોકાર અને આયોજન સમિતિના સદસ્યો દ્વારા કરવામાં આવેલ.
તેમજ રાત્રે નેહલ બેન ગઢવી નું પ્રેરક સામાજિક પ્રકરણ ને અનુલક્ષી પ્રેરણાદાયક પ્રવચન થયું હતું.

**મહોત્સવના મંગલમય અવસરો**
સંવત ૨૦૮૦, શ્રાવણ વદ ૫-૬ ને શનિવાર, તા. ૨૪-૦૮-૨૦૨૪
**સવારના ૭:૦૦ વાગ્યે:** : ચા-નાસ્તો.
**સવારના ૮:૦૦ વાગ્યાથી બપોર સુધી :**


નાગવીરીમાં ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત સર્વે મહેમાનોને સામાજિક પ્રેરક વક્તવ્ય આપતા નેહલબેન ગઢવી

રાજરાજેશ્વર મહાદેવ-પાટોત્સવ વિધિ, તેમજ.. સ્થાપિત દેવો ની પ્રાતઃ પૂજા, શાન્તિક-પૌષ્ટિક આહુતિઓ, મૂર્તિ પ્રતિષ્ઠા, કળશ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, મૂર્તિપૂજા, વસ્ત્રાભિધાન, યજમાન દંપતીઓ દ્વારા મહાઆરતી, શ્રીફળ

નાગવીરી ગામે હરખભેર સંતોના સામૈયા

હોમ, પૂર્ણાહુતિ.

**ચોથો દિવસ**

નૂતન મંદિર મૂર્તિ સ્થાપના થી નગર યાત્રા જલયાત્રા

સાથે સાથે સવાર થી બપોર સુધી, શાળા ખાતે બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ.
**બપોરના ૧૨:૦૦ વાગ્યે** :ભોજન/મહાપ્રસાદ.
**બપોર પછી ૩:૦૦ વાગ્યે** : દાતાઓશ્રીઓ-કાર્યકર્તાઓનું સન્માન તથા ખૂલ્લો મંચ.
**સાંજે ૭.૦૦ વાગ્યે** : સમૂહ પ્રસાદ.
**રાત્રે ૮.૦૦ વાગ્યે** : ભજન-લોકડાયરો. (શ્રી ધીરુભાઈ પોકાર - પાંતિયા વાળા તથા સાથી કલાકારો દ્વારા).

આ ઉપરાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા કાર્યરૂપી વૃંદાવનધામ સભા મંડપમાં રવાપર પીએચસી સ્ટાફ સેવા આપી રહ્યો છે.. આયોજન સમિતિના ચેરમેન દેવશી લીંબાણી, સમાજ પ્રમુખ શિવજી પોકાર, મહામંત્રી હીરાભાઈ પોકાર, અગ્રણી દાતાઓ ડાયાભાઈ લીંબાણી, ગોવિંદ લીંબાણી, રતનશી પોકાર, ગોવિંદ ભાદાણી, કલાબેન ભાદાણી, શાંતાબેન



કાર્યાલયમાં ઉપસ્થિત નાગવીરી સમાજ આગેવાનો

પોકાર વગેરે હાજર રહ્યા હતા.

જલ યાત્રામાં કડવા પાટીદાર સમાજ જનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટ્યો.. સવારે વાજતે ગાજતે ભવ્ય જલયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના ભાઈ- બહેનો જોડાયા હતા.

બપોર બાદ સંતોનું સામૈયું કરાયું હતું. જેમાં સ્વામિનારાયણ મંદિર જેતલપુર.

મહોત્સવ નિમિત્તે ગામના 26 દિકરા દીકરીઓનું વિશિષ્ટ સન્માન ઈત્તર પ્રવૃત્તિઓમાં સ્ટેટ અને નેશનલ લેવલમાં પાર્ટિસિપેટ કરી વિજય થવા બદલ આપેલ જેમ કે પેન્ટિંગ, શૂટિંગ, સ્કેટિંગ, શોર્ટ ક્રિકેટ, વર્લ્ડ રેકોર્ડ ફોર broom ડાન્સ

અમદાવાદના સદગુરુ શાસ્ત્રી પુરુષોત્તમ પ્રકાશ સ્વામીએ કહ્યું કે શત્રુને મિત્ર બનાવી શકે એ મંદિરનું નિર્માણ કરી શકે... સંતશ્રીઓના પ્રેરક અને ઉદબોધક પ્રવચન અને જ્ઞાન-પીરસ્તા

સદગુરુ શાસ્ત્રી શ્રી પુરુષોત્તમ પ્રકાશ સ્વામી સ્વામિનારાયણ મંદિર જેતલપુર (અમદાવાદ) ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સભા જનોને આશિષ આપતા



કડવા પાટીદાર કુલદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા તરફથી નાગવીરી ગામે ચાલતો ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શુભેચ્છા પત્ર


ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નગરજનોનો ઉત્સાહ

દાતાશ્રીઓ હસ્તે શ્રી વાછડા દાદા ગંગાજી દર્શન અને પૂજન

શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રમુખશ્રી ગોપાલ બાપા નું સંબોધન...

કેન્દ્રીય પ્રમુખશ્રીએ પોતાના સંબોધનમાં નાગવીરી ના યુવાનો અને ભાઈઓ- બહેનો ને આ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ ખૂબ વધાઈ આપી અને કહ્યું કે નાગવીરી એ જે કાર્ય કર્યું છે એ અમારા આ 24 ગામ સર્વ શ્રેષ્ઠ કાર્ય છે...વડીલો ના, નિયાણીઓ ના સન્માન અને દરેક નિયાણી નામે ૯૦૦ વૃક્ષોનું વાવેતર એ કાબિલે તારીફ અને નોંધ વર્ધક છે.. "એક વૃક્ષ નિયાણી કે નામ.. નાગવીરી સંતોની વડીલોની તપોભૂમિ છે તેના આશીર્વાદ થકી આજે ગ્રામજનોએ આવો ઉમદા ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે.

## શ્રી અખિલ ભારતીય નેત્રા યુવક મંડળની નૂતન હોદ્દેદારોની વરણી

શ્રી અખિલ ભારતીય નેત્રા પાટીદાર સનાતન યુવક મંડળની નવીન હોદ્દેદારોની વરણી તારીખ 21/08/2024 ના શુભ દિવસે શ્રી અખિલ નેત્રા યુવક મંડળની જનરલ સભા ગોવિંદભાઈ માકાણી ના અધ્યક્ષ સ્થાને યોજાઇ,જેમાં સમાજના ઝોન મુજબ કારોબારીની રચના કરવામાં આવી તેમાં સર્વાનુમતે હોદેદાર શ્રીની વરણી કરવામાં આવેલ.
સંયોજક-ભવાન જાદવાણી, કામરેજ

**શ્રી અખિલ ભારતીય નેત્રા પાટીદાર સનાતન યુવક મંડળ, હોદ્દેદારો-2024-26**
પ્રમુખશ્રી - ગોવિંદભાઇ ભાણજીભાઇ માકાણી,સુરત
ઉપ પ્રમુખ-રાજેશભાઇ હરજીભાઇ સાંખલા,નેત્રા
ઉપ પ્રમુખ-ભવાનભાઇ હરજીભાઇ નાકરાણી,મહેસાણા
મહામંત્રી- CA મુકેશભાઇ કિશોરભાઇ માકાણી,સુરત
ખજાનચી-ભરત દીનેશભાઇ માકાણી,નેત્રા
સહમંત્રી-નીતીન બાબુભાઇ જબવાણી,નખત્રાણા
સહમંત્રી-મનીષ નાનજીભાઇ નાકરાણી,ઇડર
સહખજાનચી-રાજેશ નથુભાઈ સાંખલા,ગોટી નાસીક

**સલાહકારશ્રીઓ**
૧-ભરત કરમશીભાઇ જાદવાણી,બીલીમોરા
૨-ભવાન ગોપાલભાઇ જાદવાણી,કામરેજ
૩-જીતેન્દ્ર રતનશીભાઇ પોકાર,બેંગ્લોર
૪-જીવરાજ પ્રેમજીભાઇ નાકરાણી,નેત્રા-મહેસાણા
૫-શંકરલાલ હીરજીભાઇ માકાણી,નેત્રા-વડોદરા
૬-મનસુખલાલ કાનજીભાઇ માંકાણી,નેત્રા
૭-ધનજી હરજીભાઇ ભાવાણી,સંબલપુર-ઓરીસ્સા
૮-પરસોતમ ડાહ્યાભાઇ નાકરાણી,બેંગ્લોર

**ઓડીટરશ્રી,**
૧-CA.દિનેશભાઇ વાલજીભાઇ માકાણી,કીમ-સુરત
૨-અમૃતલાલ મનજીભાઇ રવાણી,ગુણાતીતપુર

## ઈન્દોરના ચિ. વિભોર ભાવાણી, વેસ્ટ ઝોન કરાટે માં ગોલ્ડ મેડલથી સન્માનિત થયા

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નવલખા ઇન્દોર મધ્ય પ્રદેશના શ્રી સ્વામિનારાયણ વિજય સોમિલ વાળા કંચનબેન જિતેન્દ્રભાઈ ભાવાણી ના સુપુત્ર વિભોરકુમાર 4th વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયન શીપમાં ગોલ્ડ મેડલ મેળવી પરિવાર તેમજ સમાજ નું ગૌરવ વધાર્યું છે તેમને ખુબ ખુબ અભિનંદન.

ટીમ પ્રચાર અને પ્રસાર સમિતિ વતી ચેમ્પિયન વિભોર કુમાર અને તેમના માતા-પિતાને વિશેષ ગૌરવવંતી સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન સાથે ઉજવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવે છે.

યુવાસંઘ એજ્યુકેશન એન્ડ ટેલેન્ટ હન્ટ મિશન તેમની વિશેષ કારકિર્દીને બિરદાવે છે.

## બિલાસપુરમાં રક્તદાન શિબિર નું આયોજન

શ્રી યુવા મંડળ બિલાસપુર દ્વારા તારીખ 11 ઑગસ્ટ 2024નાં રોજ રવિવારે સવારના 8:30 કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

સર્વપ્રથમ શ્રીસમાજ ના પ્રમુખશ્રી રમેશભાઈ ધનજીભાઈ સામાણી, મહામંત્રી દિનેશભાઈ લધાભાઈ ધોળું તેમજ યુવા મંડળના પ્રમુખ કાંતિભાઈ બાબુભાઈ ગોરાણી સાથેજ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુરેશભાઈ ધોળું અને મહામંત્રી શ્રીમતી મધુબેન કિશોરભાઈ સામાણી અને ત્રણેય પાંખના પદાધિકારી અને સમાજના વડીલોની ઉપસ્થિતિમાં કુળદેવી શ્રી ઉમિયામાઁ ના સામે દીપ પ્રાગટ્ય અને માલર્યાપણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન સાથેજ વિવિધ પ્રકારના બ્લડ ચેકઅપ નિઃશુલ્ક કરવામાં આવેલ હતા જેમાં 120 સભ્યોના વિવિધ પ્રકારના બ્લડ ચેકઅપ કરવામાં આવેલ અને 46 યુનિટ બ્લડ ડોનેશન પણ કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે યુવા મંડળના પ્રમુખ કાંતિભાઈ બાબુભાઈ ગોરાણી દ્વારા સર્વે દાતાઓનું અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે સભ્યો અને મહિલા શક્તિનો ખાસ યુવા મંડળ વતી હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવેલ.

બિલાસપુર મહિલા શક્તિએ ઉજવ્યો વીરપસલી પર્વ

બિલાસપુર મહિલા મંડળ દ્વારા રક્તદાન શિબિરમાં સહયોગ સાથે વીરપસલી નું આયોજન શ્રાવણ માસના પ્રથમ રવિવાર 11 ઑગસ્ટના બપોરે 4:00 કલાકે પાટીદાર ભવન બિલાસપુર ખાતે ભાઈની રક્ષા અને ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવો વીરપસલીનો ત્યોહાર ધૂમધામ થી ઉજવવામાં આવેલ. સૌપ્રથમ સમાજની માતાઓ દ્વારા ત્યારબાદ બહેનો અને દીકરીઓ દ્વારા રાસ લેવામાં આવેલ, એક રાસ સમાજના વડીલો અને ભાઈઓ દ્વારા લેવામાં આવેલ. અંતે મહિલા મંડળની માતાઓ અને બહેનો દ્વારા સાંજ પુરાવી અને રાસ પૂર્ણ કરવામાં આવેલ. આ પ્રસંગે સમાજના કારોબારી સભ્યો ,વડીલો, યુવક મંડળના કારોબારી સભ્યો અને યુવા મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે મહિલા મંડળના મહામંત્રી દ્વારા સર્વે નો આભાર પ્રગટ કરવામાં આવેલ.

રક્તદાન શિબિરમાં ઉપસ્થિત બિલાસપુર સમાજના આગેવાનો

## પાક નુકસાનીને લઈ ખેડૂતોને ચૂકવાશે 350 કરોડ રૂપિયાની પાક સહાય

જુલાઈ મહિનામાં રાજ્યમાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું. કૃષિ વિભાગ દ્વારા રાજ્યનાં 9 જીલ્લાનાં 45 તાલુકામાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં SDRF ના નિયમ પ્રમાણે 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે.

આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદયે રૂ. ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

## આજે શ્રાવણ વદ "રાંધણ છઠ"

શીતળા સાતમના અગ્રદૂત તરીકે સેવા આપતો તહેવાર એટલે રાંધણ છઠ... તહેવાર ન હોવા છતાં, રાંધણ છઠ શીતળા સાતમની તૈયારીઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવે.. જે દેવી માઁ શીતળા દેવીને સમર્પિત છે. શીતળા સાતમ પર, તમામ પ્રકારની ગરમ રસોઈ પર પ્રતિબંધ, તેથી પરિવારો રાંધણ છઠનો ઉપયોગ અગાઉથી ભોજન તૈયાર કરવા માટે કરે..જેને 'રાંધન છઠ' નામનો અનુવાદ 'છઠ્ઠા દિવસે રસોઈ' થાય છે, જે ભોજનની તૈયારીમાં દિવસના મહત્વને દર્શાવે છે.

સનાતન ધર્મમાં શ્રાવણ માસ વિવિધ ધાર્મિક વિધિઓ માટે જાણીતો છે. આ મહિનામાં ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરતી જન્માષ્ટમી અને કૃષ્ણના મોટા ભાઈ બલરામના જન્મદિવસની ઉજવણી કરતી બલરામ જયંતિ સહિત અનેક મહત્વપૂર્ણ તારીખો અને તહેવારો છે જેમાંનો એક તહેવાર રાંધણ છઠ...

રાંધણ છઠને રસોઈ અને ભોજનની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઓળખવામાં આવે છે, જે પછીના દિવસના ધાર્મિક પાલન માટે સ્ટેજ સેટ કરે છે... મુખ્યત્વે બાળકોની રક્ષા માટે માનવામાં આવતી દેવી શીતળા માતાની પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરતા... આ પરંપરાને માન આપવા માટે, પરિવારો આ દિવસે રસોઈ કરવાનું ટાળે છે, અને રાંધણ છઠ પર તૈયાર કરવામાં આવેલ ઠંડુ ભોજન દિવસની ધાર્મિક પ્રવૃત્તિઓ પછી ખાવામાં આવે છે...શીતળા માતાની પૂજામાં શ્રદ્ધાથી સહભાગી થવા સાથે કૌટુંબિક પરંપરાઓ અને આદરને સમર્પિત દિવસ જે સુનિશ્ચિત કરે છે કે શીતળા માતાની આગલા દિવસની પૂજા સરળતાથી અને પરંપરા અનુસાર કરવામાં આવે.

જ્ઞાન-વિજ્ઞાન સાથે જોડાયેલા આપણા આ તહેવારોમાં નો એક તહેવાર રાંધણ છઠની સૌને હાર્દિક શુભકામનાઓ...

## નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ?

આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ કેન્દ્રમાં રેકોર્ડ ત્રીજી વખત સરકાર બનાવી છે. હવે જ્યારે વડાપ્રધાન મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો થાય તે પહેલા 75 વર્ષની વય વટાવી જશે ત્યારે સ્વાભાવિક રીતે જ લોકો વિચારી રહ્યા છે કે મોદી પછી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હોઈ શકે.??

આ પ્રશ્ન માત્ર રાજકીય વિશ્લેષકોને જ નહીં, પણ ભાજપના સમર્થકોને પણ વિચારવા મજબૂર કર્યા છે કે 'મોદી પછી કોણ..?'

ઑગસ્ટ 2024માં બહાર પાડવામાં આવેલા મૂડ ઑફ ધ નેશન સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ભાજપમાં નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાન તરીકે કોને જોવા ઈચ્છે છે. સર્વેમાં ભાગ લેનારા લોકોના અભિપ્રાય મુજબ, કેટલાક સંભવિત ઉમેદવારોના નામ સામે આવ્યા છે જેઓ ભવિષ્યમાં મોદીનું સ્થાન લઈ શકે છે. સર્વે દર્શાવે છે કે 25%થી વધુ લોકોએ અમિત શાહને સમર્થન આપ્યું છે. યોગી આદિત્યનાથ અને નીતિન ગડકરી જેવા બીજેપીના અન્ય વરિષ્ઠ નેતાઓની તુલનામાં લોકોએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે મોખરે રાખ્યા છે. એટલે કે સર્વેનું માનીએ તો લોકો અમિત શાહને નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે ભાજપના વડાપ્રધાનપદના ચહેરા તરીકે જોવા ઈચ્છે છે...લગભગ 19% લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બીજા સ્થાને રાખ્યા છે. સર્વે અનુસાર, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી 13% વોટ મેળવીને ભગવા પાર્ટીમાં ટોચના પદ માટે ત્રીજા સૌથી વધુ પસંદગીના વ્યક્તિ છે. આ ત્રણેય નેતાઓ પછી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ

નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે કોણ?

ચૌહાણ લગભગ 5% ટકા વોટ સાથે છે. સર્વેક્ષણમાં અમિત શાહ અગ્રેસર હોવા છતાં, ફેબ્રુઆરી 2024 અને ઓગસ્ટ 2023ના અગાઉના સર્વેની તુલનામાં તેમની 25%ની મંજૂરી રેટિંગમાં ઘટાડો દર્શાવે છે. છેલ્લા બે સર્વેમાં 28% અને 29% લોકોએ પીએમ મોદીના અનુગામી તરીકે ભાજપના નેતાઓમાં અમિત શાહને પસંદ કર્યા હતા.

## અંતરિક્ષમાં કેમ ફસાયેલા છે સુનિતા વિલિયમ્સ? ઈસરો ચીફ ડૉ. એસ. સોમનાથે જણાવ્યું કારણ

બોઇંગ કંપની દ્વારા ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ૦૫ જૂનના રોજ ઓપરેશન ક્રુ ટેસ્ટ ફ્લાઈટ મિશન માટે સ્ટારલાઈનર અવકાશયાન થકી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલાવવામાં આવ્યા. સુનિતા વિલિયમ્સ બોઈંગ સ્ટારલાઈનરના ક્રુ મિશનમાં ઉડાન ભરનારા પ્રથમ મહિલા અવકાશયાત્રી છે. બંને અવકાશયાત્રી આ મિશન ૦૮ દિવસમાં પૂર્ણ કરીને પરત ફરવાના હતા. પરંતુ અવકાશયાનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે ૦૨ મહિના હોવા છતાં અવકાશયાત્રી પરત ફરી નથી શક્યા.

**કઈ ટેકનિકલ ખરાબી નડી ગઈ?**

ઈસરો ચીફ ડૉ. એસ. સોમનાથે જણાવ્યું કે બોઈંગને આ સ્પેસ મિશનની શરૂઆતથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જ્યારે તેની લોન્ચિંગ સફળતાપૂર્વક થઈ ગઈ અને બંને અંતરિક્ષયાત્રીઓ સ્પેસ માં પહોંચી ગયા તો તેમને પાછા લાવવા માટે સ્પેસક્રાફ્ટનું ઈવેલ્યુએશન શરૂ થયું. તે સમયે તેમાં કેટલીક ખામીઓ વિશે જાણવા મળ્યું અને તપાસમાં ખબર પડી કે અંતરિક્ષયાન માં હિલીયમ ગેસ લીક થઈ રહ્યો હતો અને અંતરિક્ષયાનના કેટલાક થ્રસ્ટર્સ કામ કરતા નથી. વધુમાં ઈસરો ચેરમેન સોમનાથે કહ્યું કે અત્યાર સુધી મળેલી જાણકારીઓ મુજબ બોઈંગના સિમ્યુલેશન પરીક્ષણોના રિપોર્ટ બરોબર આવ્યા છે. જો કે આ અંગે સાચું મૂલ્યાંકન અમેરિકાની અધિકૃત એજન્સી કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર પૃથ્વી પર પાછા ક્યારે આવશે, તેનો સ્પેસક્રાફ્ટની ફિટનેસ સાથે ગાઢ સંબંધ છે. જ્યાં સુધી સ્પેસક્રાફ્ટની કંટ્રોલ સિસ્ટમ, થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ અને બાકી અન્ય પ્રણાલીઓ યોગ્ય રીતે કામ કરતી ન થાય, ત્યાં સુધી બંને અવકાશયાત્રી ને સુરક્ષિત રીતે ધરતી પર

નાસા અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર

ઉતારવા અસંભવિત છે.

**મિશનથી ભારત પણ લઈ રહ્યું છે સબક!**

ડૉ. એસ. સોમનાથે કહ્યું કે સુનિતા વિલિયમ્સની આ સફરથી ભારત પણ પાઠ ભણી રહ્યું છે. અમે પણ ગગનયાનની તૈયારીઓ કરી રહ્યા છીએ. આવામાં સુનિતા વિલિયમ્સ જેવી પરિસ્થિતિઓ અમારી સાથે પણ ઉદભવી શકે છે. આથી અમે પણ આવી સ્થિતિને બારીકાઈથી દેખરેખ રાખી બીજા દેશોની એજન્સી ઓના પ્રયત્નોને પણ જોઈ રહ્યા છીએ. જેનાથી આકસ્મિક સંજોગોમાં એક્શન લઈ શકાય.
સંકલન: કિશન નાકરાણી, ભાલેજ

**સુનિતા વિલિયમ્સ વિશે ટૂંકો પરીચય**
- સુનિતા વિલિયમ્સનો જન્મ યુક્લિડ અમેરિકામાં થયો છે. તેઓ મૂળ મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામનાં વતની હતાં.
- તેમણે મેસેચ્યુસેટ્સ ના નીડહામ ખાતે નીડહામ હાઇસ્કૂલમાં શિક્ષણ લીધું હતું અને 1983માં સ્નાતક થયા હતા. 1987માં તેમણે યુ.એસ. નૌકાદળ તાલિમ કેન્દ્રમાંથી ભૌતિક વિજ્ઞાનમાં બેચલર ઓફ સાયન્સ ની પદવી મેળવી હતી.
- સુનિતા નેવીમાં કેપ્ટન પદેથી નિવૃત્ત થયા બાદ 1998માં NASA માં અવકાશ યાત્રી તરીકે પસંદગી પામ્યા હતાં. તેમણે અત્યાર સુધી 322 દિવસ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વીતાવ્યા હતા અને ત્યાં 07 વખત સ્પેસવોક કરી હતી. તેઓ મહિલા અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર કરવાનો વિક્રમ ધરાવે છે.
- સુનિતા વિલિયમ્સને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ (2008) પણ મળેલ છે.

## પોલેન્ડથી ટ્રેનમાં મુસાફરી કરી મોદી યુક્રેન પહોંચ્યા

### છેલ્લા ૩૦ વર્ષમાં પ્રથમવાર ભારતીય વડાપ્રધાન યુક્રેનની મુલાકાતે : બે વર્ષમાં મોદી અને ઝેલેન્સકી ત્રીજી વખત એક બીજાને મળશે

રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતના અઢી વર્ષ બાદ વડાપ્રધાન મોદી યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા છે. તે ગુરુવારે રાત્રે પોલેન્ડથી રવાના થયા હતા. તેઓ ૧૦ કલાકની ટ્રેનની મુસાફરી બાદ યુક્રેન પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી યુક્રેનની રાજધાની કિવમાં ૭ કલાક વિતાવશે.

પીએમ મોદી યુક્રેનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. ૧૯૯૧માં સોવિયેત યુનિયનના તૂટવાના કારણે યુક્રેનની રચના થઈ ત્યારથી કોઈ ભારતીય વડાપ્રધાને તેની મુલાકાત લીધી નથી.

પીએમ મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી નાટો દેશો સિવાય અન્ય કોઈ દેશના નેતાએ યુક્રેનની મુલાકાત લીધી નથી.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ થોડા મહિના પહેલા પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. અગાઉ, મોદી અને ઝેલેન્સકી મે ૨૦૨૩માં જાપાનમાં જી-૭

સમિટ દરમિયાન યુદ્ધ પછી પહેલી વાર મળ્યા હતા. કિવ પહોંચ્યા બાદ પીએમ મોદી હયાત રિજન્સી હોટેલ પહોંચ્યા. તેઓ અહીં હાજર ભારતીયોને મળશે. ભારતીય વડાપ્રધાન યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગયા છે. તેઓ ગુરુવારે રાત્રે પોલેન્ડની રાજધાની વોર્સોથી નીકળી ગયા હતા. પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરવાના છે.

ભારતીય વડાપ્રધાન યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગયા છે. તેઓ ગુરુવારે રાત્રે પોલેન્ડની રાજધાની વોર્સોથી નીકળી ગયા હતા. પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરવાના છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોની ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે આશા વ્યક્ત કરી કે પીએમ મોદીની યુક્રેનની મુલાકાત શાંતિ લાવવામાં મદદરૂપ સાબિત થશે. દુજારિકે કહ્યું કે અમે ઘણા મોટા દેશોના નેતાઓને તાજેતરના ભૂતકાળમાં કિવની મુલાકાત લેતા જોયા છે. અમને આશા છે કે આ મુલાકાતોની અસર પડશે.

## વિરાણી ગામે જન્માષ્ટમી પર્વ નિમિત્તે પધારેલા સમાજજનોનો મેળાવડો

સમાજવાડી ભવન એક સંસ્કૃતિનું ઊર્જા કેન્દ્ર હોય છે. આવા સનાતની જાગૃત સમાજ ભવન નું આધુનિકરણ સાથેનું નિર્માણની સમીક્ષા કરતા વિરાણીનાં ભારતભરનાં સાહસિકો સાથે સ્થાનિક સુરેશભાઈ કાનજીઆણી

નખત્રાણા તાલુકાના વિરાણી (મોટી) ગામમાં જન્માષ્ટમી માણવા કચ્છ ગુજરાત અને અન્ય રાજ્ય નાં વિવિધ ગામથી, ભારતભરમાંથી આવેલા વિરાણી ગામના મૂળ રહેવાસીઓ તેમજ સ્થાનિકો સાથે સનાતની સમાજનું નવનિર્મિત સંસ્કૃતિ સમાજ ભવન ની સમીક્ષા લેતા સૌ ઉત્સાહિત સમાજ આગેવાનો. આ વિરાણી ગામ સનાતની જાગૃતિ નાં પથ દર્શક નારાયણ રામજી લીંબાણી અને તેના બાદ રતનશી ખેતાણી જેવા અમલીકરણ કરાવનાર જાગૃત અને ઉજગર વ્યક્તિઓનું ગામ છે. આ ગામ ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાનું ગામ છે. અહી પક્ષી અભયારણ્યનું રિસર્ચ સેન્ટર છે

કેન્દ્રીય સમાજ નેં આજ સુધી ચાર પ્રમુખ આપ્યા નું ગામ છે.

સંત લક્ષ્મીદાસ નાં દ્વારા નું આં ગામ અને અહીંથી તપસ્વી ધોરમાનાથા નો ધીનોધર પર્વત નો અહેસાસ આરંભ થાય તેવું આં વિરાણી ખંત ખમીર અને ખાનદાની નું ગામ..

ત્યાં સમાજ ભવન આધુનિક યુગમાં જરૂરી શિલ્પ આકાર લઇ રહેલ છે.. ત્યારે સવિશેષ તેની મુલાકાત અને ચર્ચા કરવાનો મેળાવડો મળ્યો. સ્થાનિક સુરેશભાઈ કાનજીઆણી અને સાથે સમીક્ષા કરતા સાહસિક વિરાણી મૂળનાં ઠેર ઠેર થી આવેલ અગ્રણીઓ.

## કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની સતર્કતા અંગે

માદરે વતન કચ્છમાં સાતમ આઠમ નિમિત્તે દેશના અલગ અલગ ભાગોથી કચ્છમાં આવતા અને પછી જતા આપણા કચ્છી માડુ માટે ખાસ પ્રવાસ દરમિયાન સાવચેતી રાખવી....:

આજે ભારત સરકાર ના ગૃહ મંત્રાલયે ગૃહમંત્રીશ્રી અમિત શાહ ના આદેશને તાત્કાલિક પ્રભાવથી દેશના સમસ્ત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ને જારી કરેલ છે કે દર બે કલાકે (Every Two hours) પોતાના પ્રદેશની કાનુન વ્યવસ્થા ની જાણકારી દેશના ગૃહ મંત્રાલય ને આપવી....

દેશની આઝાદી પછી આવો ઓર્ડર પ્રથમ વખત જ આપવામાં આવ્યો છે જે દર્શાવે છે કે દેશમાં આવતા સમયગાળામાં કાંઈક નવાજૂની બની શકે છે...

તો આ ઓર્ડરને ધ્યાનમાં રાખી સડક માર્ગે અથવા રેલ્વે દ્વારા પ્રવાસ કરતા સમયે પોતાની સલામતી અંગે સાવધ રહેવું...

સડક માર્ગે પ્રવાસ કરતી વખતે વિધર્મી બહુલ ક્ષેત્રમાં રાત્રે પ્રવાસ ટાળવો અથવા સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સાથે પ્રવાસ કરવો...

સુરક્ષાનાં સાધનો રાખવા અને જે માર્ગે જતા આવતા હો ત્યાં આવતા આપણો સમાજ ના પરીવાર નાં મોબાઈલ નબર ફોન બુક માં જરૂર રાખવા..

મહિલાઓ અને બાળકો સાથે હોય તો અશાંત વિસ્તારમાં રાત્રે ટ્રાવેલીંગ ન કરવું હિતકારી છે.

જાગૃત અને ઉજાગર - સનાતન ધર્મ પત્રિકા

### અવસાન નોંધ

તારીખ 22/08/2024
સ્વ. નીતીન ગોપાલભાઈ ભાવાણી
ઉંમર વર્ષ: 37 કચ્છમાં : મથલ, હાલે : ચૌફુલા (પુના)
તારીખ 23/08/2024
સ્વઃ ભરતભાઈ શીવગણભાઈ મૈયાત
ઉંમર વર્ષ: 63 કચ્છમાં : વિગોડી, હાલે : પિનીયા, બેંગ્લોર
સ્વઃ જનીબેન સોમજીભાઈ વાસાણી
ઉંમર વર્ષ : 65 કચ્છમાં : જતાવીરા, હાલે : બાંદા (મહારાષ્ટ્ર)

ૐ નમો નારાયણાય - શ્રીમદ્ ભગવદ્ ગીતા
ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમ્ અવસાદયેત્ |
આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ ||
(અ.૬-૫)
વિવેકયુક્ત મન વડે જીવાત્માનો ઉદ્ધાર કરે, જીવાત્માને અધોગતિમાં ન લઈ જાય, કેમ કે આ જ્ઞાનયુક્ત મન જ જીવાત્માનો મિત્ર છે અને જ્ઞાનરહિત મન જ જીવાત્માનો શત્રુ છે.
જ્ઞાનદર્શક સંત વલ્લભકૃષ્ણના જય શ્રી લક્ષ્મીનારાયણ

H.K. DOORS
BEAUTIFUL AND STRONG DOORS FOR YOUR HOME
HK DOORS First IMPRESSION of your HOUSE
TERMITE-RESISTANT | FIRE-RESISTANT | DURABLE
HEAD OFFICE
Sri Narayan Timber, Survey No. 186/187, Plot No. 7,8,9, Chudva Gandhidham - 370201, Kutch, Gujarat - India.
Hareshbhai Rudani - Mo. +91 99791 57883
BRANCH OFFICE
1. DHARWAD - KARNATAKA Kishorbhai - Mo. +91 94826 95508
2. HYDERABAD - TELANGANA Bhaveshbhai - Mo. +91 78934 59459
3. CHENNAI - TAMILNADU Vivekbhai - Mo. + 91 98843 12266 Janakbhai - Mo. +91 98413 88663
4. VIJAYWADA - ANDHRA PRADESH Rajeshbhai - Mo. +91 78428 05202
5. MARGAO - GOA : Kirtibhai - Mo. +91 70202 74705
KishorBhai Rudani: 9979352929
H.K. TIMBER PVT. LTD.
TIMBER IMPORTER AND ORDER SUPPLIERS
HEAD OFFICE
Survey No. 186/187 Plot No. 6
Gandhidham - 370 201, Kutch, Gujarat - India.
PRAMUKH ENTERPRISE
EXPOTER AND TIMBER IMPORTER
HEAD OFFICE
Flat No. 3, Ground Floor, Plot No. 26, Sector - 3, Matru Chhaya Appartment, Gandhidham Kutch, Gujarat - 370 201.
Bharatbhai Rudani - Mo. +91 99791 57884
H.K. FRUITS
HEAD OFFICE
45, Gopalnand Chock, Gunatitpur, Kumbharadi, Kutch, Gujarat - 370 140.
Jagdishbhai Rudani - Mo. + 91 99254 98648
Dhirajbhai Rudani - Mo. + 91 99784 49205

પત્રવ્યવહાર : ૫૦૧– ૫૦૪, પાંચમો માળ,નરોડા બિઝનેસ હબ કોમ્પલેક્ષ, નરોડા–દહેગામ રોડ,એસ.પી.રિંગ રોડ પાસે,નરોડા–અમદાવાદ. ૩૮૨૩૩૦. મો. ૭૮૦૧૮૭૭૭૭૪